



CIN # L99999GJ1987PLC009768

Regd. Office: 9/10, GIDC Industrial Estate, WAGHODIA, Dist.: Vadodara

Ph. # 75 748 06350 E-Mail : co_secretary@20microns.com

Website : www.20microns.com

21st June, 2024

TO :

BSE LIMITED Department of Corporate Services Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, MUMBAI – 400 001. SCRIP CODE : 533022	NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED Listing Department Exchange Plaza, Bandra – Kurla Complex, Bandra [East], MUMBAI – 400 051. SYMBOL : 20MICRONS
---	--

Dear Sir/Madam,

Sub: Newspaper Publication for Notice of 37th Annual General Meeting of the Company.

With reference to the Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith copies of newspaper publications/advertisements of Notice in respect of 37th Annual General Meeting to be held on Friday, 19th July, 2024, at 11:00 A.M. through Video Conferencing/Other Audio Visual Means, published in :-

- Business Standard [Eng.], Ahmedabad and
 - Loksatta [Guj.], Vadodara
- both dated 21.06.2024.

The newspaper publications/advertisements are sent herewith.

We request your good offices to take the above on records.

Thanking you,

Yours faithfully
For 20 Microns Limited

KOMAL Digitally signed
by KOMAL
PANDEY
PANDEY Date: 2024.06.21
12:33:28 +05'30'

[Komal Pandey]
Company Secretary
Membership # A37092

Encl : As above.



INDUSIND BANK LIMITED

FRR Dept, 11th Floor, Tower 1, One World Centre, 841, Senapati Bapat Marg, Prabhadevi, Mumbai 400013

[Appendix - IV-A] [See proviso to rule 8 (6) r/w 9(1)]
PUBLIC NOTICE FOR E-AUCTION SALE OF IMMOVABLE PROPERTY
 E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("SARFAESI Act") read with proviso to Rule 8 (6) r/w 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s), Guarantor(s) & Mortgagors that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of IndusInd Bank Limited. The Authorized Officer of IndusInd Bank Limited hereby intends to sell the below mentioned secured property for recovery of dues and hence the tenders/bids are invited in sealed cover for the purchase of the secured property. The property shall be sold in exercise of rights and powers under the provisions of sections 13 (2) and (4) of SARFAESI Act, on "As is where is", "As is what is", and "Whatever there is" and "Without recourse Basis" for recovery of amount shown below in respective column due to IndusInd Bank Limited as Secured Creditor from respective Borrower, Guarantors & Mortgagors as shown below. Details of the Borrower(s), Guarantors & Mortgagors, Securities, Owner, Outstanding Dues, Date of Demand Notice sent under Section 13(2), Possession Date, Reserve Price, Bid Increment Amount, Earnest Money Deposit (EMD), Date & Time of Inspection is given as under:

Sr. No.	Name of Borrower(s)/ Guarantors/ Mortgagors	Details of the Secured Asset	Owner of the property	Outstanding Dues as on 31.03.2024 (IN INR)	Demand Notice Date	Possession Date	Reserve Price (IN INR)	Bid Increment Amount (IN INR)	EMD (IN INR)	Date & Time of Inspection
1.	M/s. Dhanixmi Plastic Industries (Borrower) Mrs. Vaishali Panchal (Guarantor) Mr. Manan Panchal (Guarantor/Mortgagor)	<p>LOT NO 1: All that the pieces and parcel of immovable property comprising of Shop No 106 on 1st Floor, Adm 32-16-49 Sq Mtrs build up construction and adm 10.03 sq mtrs undivided land share (As per Sale Deed No 1153/2021) in the scheme know as Shree Kham divine Commercial Complex situated at Block No 941/B Paiki of Mouje : Khatraj Taluka Mahemdabad and District Kheda 382330.</p> <p>LOT NO 2: All that the pieces and parcel of immovable property comprising of Shop No 107 on 1st Floor, Adm 30-48-53 Sq Mtrs build up construction and adm 9.38 sq mtrs undivided land share (As per Sale Deed No 1154/2021) in the scheme know as Shree Kham divine Commercial Complex situated at Block No 941/B Paiki of Mouje : Khatraj Taluka Mahemdabad and District Kheda 382330.</p> <p>LOT NO 3: All that the pieces and parcel of immovable property comprising of Shop No 109 on 1st Floor, Adm 40-20-62 Sq Mtrs build up construction and adm 12.54 sq mtrs undivided land share (As per Sale Deed No 1156/2021) in the scheme know as Shree Kham divine Commercial Complex situated at Block No 941/B Paiki of Mouje : Khatraj Taluka Mahemdabad and District Kheda 382330.</p>	Manan Panchal	Rs 74.38 Lakhs	14.12.2022	09.01.2024	Lot No 1 Rs. 14.50 Lakhs Lot No 2 Rs. 13.50 Lakhs Lot No 3 Rs. 18.00 Lakhs	Lot No 1 Rs 25,000/- Lot No 2 Rs 25,000/- Lot No 3 Rs 25000/-	Lot No 1 Rs 1.45 Lakhs Lot No 2 Rs 1.35 Lakhs Lot No 3 Rs 1.80 Lakhs	04.07.2024 11.00 AM to 1.00 PM 04.07.2024 11.00 AM to 1.00 PM 04.07.2024 11.00 AM to 1.00 PM

Account No: 0001356404005, Name of the Beneficiary :Sundy Deposit Asset MGT Bank Name: IndusInd Bank Limited, Branch: Opera House Mumbai, IFSC Code: INDB0000001

DATE OF E-AUCTION & TIME :
 12.07.2024 Lot No 1 11.00 am to 12.00 pm 12.07.2024 Lot No 2 12.00 pm to 1.00 pm 12.07.2024 Lot No 3 1.00 pm to 2.00 pm

LAST DATE AND TIME FOR SUBMISSION OF BID LETTER OF PARTICIPATION/KYC DOCUMENT/PROOF OF EMD :
 11.07.2024 till 4.00 pm

For detailed terms and conditions of the sale, please refer to the link provided in Secured Creditor's website i.e. www.indusind.com or https://sarfaesi.auctiontiger.net or contact Mr Farhad Jiwani Mobile No 9619900667.

STATUTORY NOTICE FOR SALE UNDER Rule 8(6) r/w 9(1) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002
 This notice is also a mandatory notice of not less than 15 (Fifteen) days to the Borrower(s) of the above loan account under Rule 8(6) r/w 9(1), of Security Interest (Enforcement) Rule, 2002 and provisions of Securitization & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, informing them about holding of auction/sale through e-auction on the above referred date and time.

Date: 21.06.2024
 Place: Ahmedabad
 Sd/- Authorized Officer
 IndusInd Bank Limited

FORM NO. NCLT-3B

To,
 Mr. Chhatrasal Singh Narendra Singh Ranawat (Respondent No. 1) (Suspended Director) Alchemist Infra Realty Limited
 Add: Nav Vadas A, P.O. Godha Tal, Modasa, Ambarbantha, Gujarat -160044

Mr. Sumit Kar (Respondent No.2) Ex-Director Alchemist Infra Realty Limited
 Add: 1511, Hemkunt Chambers, 89 Nehru Place, New Delhi -110019

Mr. Sunil Kanti Kar (Respondent No. 4) Ex-Director, Alchemist Infra Realty Limited
 Add: 14, Southend Park Lane, Kolkata - 700029

Mr. Chandra Shekhar Chauhan (Respondent No. 5) Ex-Director Alchemist Infra Realty Limited
 Add: House No. 249, Pocket 9, Sector 21, Rohini, Sultanpuri (C-Block, New Delhi 110086

Subject: Notice of application filed Under Section 66 of Insolvency & Bankruptcy Code 2016 ("IBC Code 2016")

TAKE NOTICE that an application bearing IA No. 1531 of 2024 Under Section 66 of IBC Code 2016 filed on 04.03.2024 by Mr. Gaurav Misra, the Resolution Professional of M/s Alchemist Infra Realty Limited ("Under CIRP") before Hon'ble National Company Law Tribunal, New Delhi, Bench-II ("Hon'ble NCLT"). The said application has been accepted and is fixed for hearing before the bench on 11.07.2024. If you desired to support or oppose the application at the hearing you should give notice thereof in writing to the undersigned and appear on the next date of hearing before Hon'ble NCLT in person or through Authorised Representative. Where you seek to oppose the application, the grounds of opposition or a copy of affidavit shall furnished with such notice. A copy of application is also furnished by the undersigned to the above mentioned Respondents who have been served through Speed Post at the last known address and available on the email ids.

DATE: 20.06.2024 PLACE: NEW DELHI Sd/- GAURAV MISRA RESOLUTION PROFESSIONAL OF ALCHEMIST INFRA REALTY LIMITED

PUBLIC NOTICE

That is client Vikrambhai Ramsangbhai Rathod, has demanded for the title clearance certificate for the property situated at Non-agricultural Plot of land in Mauje Vasad, Anand lying being land bearing Survey No. 152/2, admeasuring 6981 Sq. Mtrs., Known as "SUNDARVAN SOCIETY" Block No. 19A/1, Plot admeasuring 102.66 Sq. Mtrs., Common Plot & Road admeasuring 51.60 Sq. Mtrs., Total admeasuring 154.26 Sq. Mtrs., Construction area admeasuring 62.10 Sq. Mtrs., at Registration District & Sub District Anand, District Anand. That the above captioned property, the Owner by Vikrambhai Ramsangbhai Rathod who become Owner through Registered Sale Deed Vikes Registration No. 3419 dated 29.05.2006. That original Sale Deed and RR is lost. We have filed complaint at Wadaj Police Station in Ahmedabad on dated 18.05.2019

Therefore if any individual, Bank or any Financial Institution has its charge or lien on the said property then within 7 days from the publication of the notice may send their objections along with the Supportive Evidence. If not send within given period then my client will initiate further proceedings.

Dt. 21.06.2024 Vadodara Under the instruction from the client

LE-EXPERT ASSOCIATES
 KHUSHBU ASHOKKUMAR MISHRA (ADVOCATE)
 3F, 15-16, Darshanam Trade Center-1, Beside Darshanam Central Park, Near Hotel Surya Palace, Sayajiganj, Vadodara. (M) 7874538288

बैंक ऑफ बड़ोदा
Bank of Baroda

Regional Office Rajkot :
 1st Floor, BOB Bldg., M.G. Road, Rajkot - 360 001

PREMISES ON LEASE FOR OUR BANK OF BARODA BHAGWAT BAZAR BRANCH, GONDAL

The Bank of Baroda, Rajkot Region Invites sealed offer in two bid system to acquire alternate Premises on Lease with the Approximate Carpet Area of 1700 to 1760 Sq. Ft. for its Bhagwat Bazar Branch at Gondal City Area. The Premises should be ready for occupation or likely to be ready for occupation within a period of 3 Months. The Intending Offerers shall submit their offers in Two Separate Sealed Cover Superscribed Technical Bid and Price Bid between 21.06.2024 to 12.07.2024 To The Regional Manager, Bank of Baroda, Regional office, 1st Floor, BOB Bldg., M.G. Road, Rajkot - 360 001 on or before 12-07-2024. Priority would be given to the Premises belonging to Public Sector Units / Govt. Departments. (For details please log in on tender section of our web site www.bankofbaroda.com.) The bank reserves its right to accept or reject any offer without assigning reasons thereof.

Date : 21.06.2024 Regional Manager

TMB Tamilnad Mercantile Bank Limited
 SACHIN BRANCH, No-2, Shree Complex, Plot -D, Block No. 180, Ground floor 180, Surat Navsari Road, Sachin G.I.D.C Sachin-394230, Gujarat, M:9879517027 Email: sachin@tmbank.in

Sale Notice for Sale of Immovable Properties through E- Auction

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) & 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the M/s. Devkrut Engineers Pvt. Ltd and Mr. Rakesh Ramesh Kumar Shah S/o. Ramesh Kumar Shah and Mrs. Umaben Rakesh Kumar Shah W/o. Rakesh Kumar Shah that below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the Physical Possession of which has been taken by the Authorized Officer of Tamilnad Mercantile Bank Limited for Sachin Branch, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis on 11.07.2024 for recovery of Rs.2,83,16,652.40 (Rupees Two Crore Eighty Three Lakh Sixteen Thousand Six Hundred Fifty Two and Paise Forty only) as on 31.05.2024 [For Cash Credit (A/c No 392700150250007) - Rs 2,72,35,850.21 + Expense Rs 10,80,802.19] plus subsequent interest and expenses due to the Tamilnad Mercantile Bank Limited, Sachin Branch. The reserve price and Earnest Money Deposit will be as under:

Brief Description of the Property	Reserve Price	Earnest Money Deposit (EMD)
All that piece and parcel of plot No. 87 measuring 68.78 Sq.mt and Plot No.88 measuring 68.78 of "Gurukurupa Society" (as per plan Plot No. 87 Shown as A/2 & Plot No. 88 Shown as A/1) on RS. No. 14/1, Paikye, Moje, Adajan, Near Croma Show Room, L.P Savani Road, Adajan Gam, Surat, to the extent of 137.56 Sq.mt and building constructed to the extent of 251 Sq.mt (Ground Floor 125 Sq.mt + First Floor - 100Sq.mt + Terrace floor - 26 Sq.mt) (Permissible Ground Floor 888 Sq. ft. + 1st floor 888 sq. ft) standing in the name of Mrs. Umaben Rakeshkumar Shah and Mr. Rakesh Ramesh Kumar Shah. Boundaries: North : Adj. 20' feet wide Society Road, South : After Margin space land of R.S.No. 14/2, East : Adj. 25' feet wide Society Road, West : Adj. Plot No. 86	1,71,00,000/-	17,10,000/-

Terms & Conditions

E - Auction website: https://sarfaesi.auctiontiger.net

Upset Price: For Rs.1,71,00,000/- (Rupees One Crore Seventy one Lakh only)

Date and time of e-auction: 11.07.2024 between 12 PM to 2 PM with auto time extension of 5 minutes each, till sale is concluded.

Earnest Money Deposit: For Rs.17,10,000/- (Rupees Seventeen lakh Ten thousand only)

Last date for submission of bid form with EMD: Bid form along with Demand Draft in favour of Tamilnad Mercantile Bank Ltd, should be submitted on or before 10.07.2024 within 06:00 pm.

Place of Submission of BID form and EMD: Authorized Officer, TAMILNAD MERCANTILE BANK LTD., Sachin Branch, No-2, Shree Complex, Plot -D, Block No. 180, Ground floor 180, Surat Navsari Road, Sachin G.I.D.C Sachin-394230, Gujarat

Bid Multiplier: Rs.10,000/- (Rupees Ten Tousand Only)

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in)
 Place: Sachin Authorised Officer Tamilnad Mercantile Bank Ltd
 Date: 20.06.2024 Ahmedabad Regional Office (For Sachin Branch)

TMB Tamilnad Mercantile Bank Ltd
 Surat Main Branch
 Office Building Complex, Bombay Market, Surat Main Branch, Surat - 395010, Gujarat
 Email: surat@tmbank.in Phone No.0261- 2368191, 2355803, 2368191, 2311271, 2311272

Auction Notice for Sale of Immovable Properties through E- Auction

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) & Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower M/s. Carp Offset, Proprietor cum mortgagor: Mr. Chirag R Talaviya, S/o.Mr.Rameshbhai Dhirubhai Talaviya and Guarantors 1. Mrs. Kajalben Rajeshbhai Talavia, W/o. Mr. Rajeshbhai Jaysukhbhai Talavia 2. Mr. Rajeshbhai Jaysukhbhai Talaviya, S/o. Rajesukhbhai Limbabbhai Talaviya and 3. Mr. Rameshbhai Dhirubhai Talaviya, S/o. Dhirubhai Shamjibhai Talaviya that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the Physical Possession of which has been taken by the Authorized Officer of Tamilnad Mercantile Bank Limited Surat Branch, will be sold "As is where is", "As is what is", and "Whatever there is" on 10.07.2024 for recovery of Rs.3,76,25,826.60 (Rupees Three Crore Seventy Six Lakh Twenty Five Thousand Eight Hundred Twenty Six and Paise Sixty only) { Term Loan-I (119700460100516) for Rs. 3,36,03,025.31, Term loan-II (119700460100558) for Rs.19,91,254.79 and Term Loan-III (119700460100559) for Rs.11,72,732/- plus expenses of Rs.8,58,814.50 } as on 31.05.2024 due to the Tamilnad Mercantile Bank Limited, Surat Branch with subsequent interest and expenses. The reserve price will be Rs. 1,28,00,000/- (Rupees One Crore Twenty Eight Lakhs Only) and the earnest money deposit will be Rs.12,80,000/- (Rupees Twelve Lakhs Eighty Thousand Only)

Description of the Property:
 All that piece and parcel of residential land to the extent of 113.12 sq.mt (i.e.1217.61 sq.ft) at R.S.No.94/2/2 & 113 Paikye, T.P.S.No.17 (Fulpada), F.P.No.135, C.T.S.No.6262, Plot No.D/51, Vallabh Nagar Co-operative Society, Besides Mohan Nagar, Near Baroda Pristage, Off.Varacha Main Road, Fulpada, Tal.Puna (Surat City), Dist Surat together with House building constructed there at ad measuring to the extent of GF 1188.00 sq. ft, FF 1260.00 sq.ft in total 2448 sq.ft standing in the name of Mr.Chirag Rameshbhai Talaviya (Approved plan for building is not obtained) Boundaries: North by : Adj.Road, South by : Adj.Wado, East by : Adj. Plot No D/52, West by : Adj. Plot No D/50

E - Auction website: https://sarfaesi.auctiontiger.net

Upset Price: Rs.1,28,00,000/- (Rupees One Crore Twenty Eight Lakhs Only)

Date and time of e-auction: 10.07.2024 between 12 PM and 2 PM with auto time extension of 5 minutes each, till sale is concluded.

Earnest Money Deposit: Rs.12,80,000/- (Rupees Twelve Lakhs Eighty Thousand Only)

Last date for submission of bid form with EMD: Bid form along with Demand Draft in favour of Tamilnad Mercantile Bank Ltd, should be submitted on or before 09.07.2024 within 06:00 pm.

Place of Submission of BID form and EMD: Authorised Officer, TAMILNAD MERCANTILE BANK LTD., Surat Branch

Bid Multiplier: Rs.10,000/- (Rupees Ten Thousand Only)

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in)
 Place: Surat Authorised Officer, Tamilnad Mercantile Bank Ltd
 Date: 20.06.2024 Surat Branch

20 MICRONS
 L I M I T E D

CIN: L99999GJ1987PLC009768

Regd. Office: 9-10, GIDC Industrial Estate, WAGHODIA - 391 760.
 Dist.: Vadodara Ph.: 75748 06350

E-mail: co_secretary@20microns.com Website: www.20microns.com

Notice of 37th Annual General Meeting and E-voting

Notice is hereby given that 37th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Friday, 19.07.2024 at 11:00 a.m. through Video Conferencing or Other Audio Visual Means (VC/OAVM), as per the provisions of the Companies Act, 2013, Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with and in compliance with the procedure prescribed vide various circulars, issued from time to time by the Ministry of Corporate Affairs ("MCA") and Securities and Exchange Board of India ("SEBI").

The Annual report of the Company for the year 2023-24, including the Financial Statements for the financial year ended 31.03.2024 ("Annual Report") along with the Notice of AGM have been sent on 20.06.2024 only by email to all those Members, whose email addresses are registered with the Company or with their respective Depository Participants ("Depository") and the Company's Registrar and Transfer Agent, Cameo Corporate Services Limited, in accordance with the MCA Circulars and SEBI Circulars.

The Annual Report along with the Notice of AGM which includes the process and manner of attending the AGM through VC/OAVM is available on Company's website at www.20microns.com, the Stock Exchanges websites at www.bseindia.com and www.nseindia.com and also available at website of NSDL (www.evoting.nsdl.com). The shareholders, who wish to receive physical copy of the Annual Report, may email their request to the Company at co_secretary@20microns.com.

The Company has provided its shareholders remote e-voting facility in compliance with the provisions of section 108 of the Companies Act, 2013 or Rules and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The company has engaged NSDL as the authorized agency to provide remote e-voting facility and e-voting at the Annual General Meeting.

Information and instructions including details of user id and password relating to e-voting have been sent to the members through e-mail. The same login credentials should be used for attending the AGM through VC / OAVM.

The manner of remote e-voting and e-voting at AGM by the members holding shares in dematerialized mode, physical mode and manner of obtaining Annual Report for members who have not registered their email addresses are provided in the Notice of the AGM and is also available on the website of the Company: www.20microns.com and will be made available on the website of the Stock Exchanges, i.e., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively. The remote e-voting facility will be available during the following voting period: Commencement of remote e-voting: 10:00 a.m. IST on Tuesday, 16.07.2024. End of remote e-voting: 05:00 p.m. IST on Thursday, 18.07.2024. The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by NSDL upon expiry of the aforesaid period.

The members who attends AGM through VC/OAVM facility and had not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting facility as may be made available during the AGM and till 30 minutes from the conclusion of the AGM. The members may participate in the meeting even after exercising their right to vote through remote e-voting but shall not be allowed to vote again during the meeting.

The Register of Members and Share transfer book of the Company will remain closed from Saturday, the 13.07.2024 to Friday, the 19.07.2024 (both days inclusive) for the purposes of AGM.

A person, whose name is recorded in the register of members or in the register of members and register of beneficial owners maintained by the depositories as on the cut-off date, i.e., Friday, 12.07.2024 only shall be entitled to avail the facility of remote e-voting or for participation and voting at the AGM. Any person, who acquires shares of the Company and becomes member of the Company after sending of the notice and holding shares as of cut-off date, may after the login ID & Password by sending a request at evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting the vote.

Payment of Dividend:
 Board of Directors at their meeting held on 17.05.2024 has recommended Dividend of Rs.1.25 (25%) per fully paid-up equity share (Face Value of Rs.5/- each), for the Financial Year 2023-24, subject to approval of the Members at the AGM of the Company. The Record date to ascertain the dividend rights shall be Friday, 12.07.2024.

Dividend, if approved at the ensuing Annual General Meeting, will be paid to the Shareholders' holding equity shares of the Company, either in electronic or in physical form, after determining eligibility of Shareholder entitled for payment of dividend, which will be based on the Record date announced by the Company i.e. Friday, 12.07.2024.

TDS on Dividend:
 In accordance with the prevailing provisions of the Income Tax Act, 1961, the Company is required to deduct tax at source (TDS) at the prescribed rates on the dividend paid to its shareholders. The TDS rate would vary depending on the residential status of the shareholders(s) and the documents submitted by them and accepted by the Company.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on : 022 - 4886 7000 or send a request to Ms. Pallavi Mhatre, Sr. Manager at evoting@nsdl.co.in

Shareholders may please note that in terms of circulars issued by MCA, the company will not send physical copies of AGM Notice and Annual Report to the Shareholders.

For 20 Microns Limited
 Komal Pandey
 Company Secretary
 Date : 20th June, 2024

TMB Tamilnad Mercantile Bank Limited
 Ringroad Branch : Plot No.25/C, 25/D, 25/E Ground Floor, Animesh House, Kinnary Cinemas, Ringroad Branch, Surat - 395002, Gujarat
 Email: surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600

Sale Notice for Sale of Immovable Properties through E- Auction

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) & Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower: M/s. Avina Enterprise Proprietor: Mr.Vasoya Arvind Valjibhai, S/o.Valjibhai Vasoya Guarantor: Mrs.Vasoya Sonal Arvindbhai, W/o. Mr. Vasoya Arvind Valjibhai. The below described Movable/immovable properties mortgaged/charged/ hypothecated to the Secured Creditor, the Physical possession of which has been taken by the Authorised Officer of Tamilnad Mercantile Bank Limited Ringroad Branch, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis on 12.07.2024 for recovery of Rs.1,36,53,770.01 (Rupees One Crore Thirty Six Lakh Fifty Three Thousand Five Hundred Twenty Seven and Paise One only as on 31.03.2024) [i.e Cash Credit (192700150950571) - Rs 1,32,40,356.71 + Expenses Rs 4,13,413.30] plus subsequent interest and expenses due to the Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch. The reserve price and Earnest Money Deposit will be as under:

Brief Description of the Property	Reserve Price	Earnest Money Deposit (EMD)
An undivided proportionate share in land and commercial shop building constructed thereat bearing shop no.40 (As per plan - Shop No.101) at 1st floor, buildup area admeasuring 1919.79 Sq. ft. (178.42 sq.mt) and carpet area admeasuring 1860.61 sq.ft (172.92 sq.mt) of "Uma Plaza" near Madhuram Chowk, Beside Sai Avenue, situated at R.S. No. 116, Block No. 183, T.P.S.No. 69, F.P.No.157, (Sub plot No. 1 admeasuring 2141 sq.mt & plot No-2 admeasuring 2645 sq.mt total 4786 sq.mt) Dindoli Kharvasa Road, Moje, Dindoli, Tal. Udhna, Dist. Surat-394305 standing in the name of Mr. Vasoya Arvind Valjibhai. Boundaries: North: Plot No-154/B, South : Plot No-3, East: 36 Mtr Road, West: 12 Mtr Road	1,25,00,000/-	12,50,000/-

Terms & Conditions

E - Auction website: https://sarfaesi.auctiontiger.net

Upset Price: For Rs.1,25,00,000/- (Rupees One Crore Twenty Five Lakh only)

Date and time of e-auction: 12.07.2024 between 11 AM to 1 PM with auto time extension of 5 minutes each, till sale is concluded.

Earnest Money Deposit: For Rs.12,50,000/- (Rupees Twelve Lakh Fifty Thousand Only)

Last date for submission of bid form with EMD: Bid form along with Demand Draft in favour of Tamilnad Mercantile Bank Ltd, should be submitted on or before 11.07.2024 within 06:00 pm.

Place of Submission of BID form and EMD: Authorized Officer, TAMILNAD MERCANTILE BANK LTD., Lot No.25/C, 25/D, & 25/E Ground Floor, Animesh house, Kinnary Cinemas, Ringroad Branch, Surat - 395002, Gujarat, email: surat_ringroad@tmbank.in Phone No.0261- 2366500., 2367600

Bid Multiplier: Rs.10,000/- (Rupees Ten Thousand Lakh Only)

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in)
 Place: Ring Road, Surat Authorised Officer Tamilnad Mercantile Bank Ltd
 Date: 20.06.2024 Ahmedabad Regional Office (For Ring Road Branch)

बैंक ऑफ बड़ोदा
Bank of Baroda

BANK OF BARODA, Bulsar (Main) Branch, Nani Khatriwad, Valsad, Tal & Dist Valsad, Pin-396001, Gujarat Ph. 02632 243230 Email : bulsar@bankofbaroda.com

NOTICE TO BORROWER (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)
 Date 13.05.2024

To,
 M/s ENGITECH INDUSTRIES PRIVATE LIMITED,
 Add.: BLOCK NO 37, Pahad Faliya, Village Nandavla, Valsad Tal Dist. Valsad 396 001
 Mr. Kishan Nitinbhai Kargathara, C-201 Pramukh Sannidhya Near ST Workshop Abrama Valsad Tal Dist Valsad
 Mr. Nitinkumar Jagjivandas Kargathara, C-201 Pramukh Sannidhya Near ST Workshop Abrama Valsad Tal Dist Valsad

Dear Sir,

Sub.: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" A/c M/s ENGITECH INDUSTRIES PRIVATE LIMITED (A/c No 02330600004570, 0233050001242)

Re: Credit facilities with our BOB BULSAR MAIN Branch.

1. We refer to our letters no. nil dated 29.12.2020 for your advance account conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanctions you have availed and started utilising the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/ credit facility accounts and the security interests created for such liability are as under:

Nature and Type of facility	Limit	Rates of Interest	Outstanding as on date 13.05.2024 (inclusive of interest upto 12.05.2024)	Security Agreement with brief description of securities
CC (0233050001242)	Rs 12,00,000/-	BRLLR+SP+Spread (6.85+0.25+2.30) =9.4%	Rs 1,285,505.48/- unapplied interest plus unsecured interest + other charges	Hypothecated plant and machinery and stock and book debts
Term Loan (02330600004570) LOC	Rs 86,00,000/-	BRLLR+SP+Spread (6.85+0.25+2.30)=9.4%	Rs 57,00,079.39+ unapplied interest plus unsecured interest + other charges	

TOTAL:- Rs 69,89,584.87/(Rupees Sixty Nine Lakhs Eighty nine thousand five hundred and eighty four and paise eighty seven only) +unapplied interest +unsecured interest plus legal charges and plus other charges if any

Description of Security Interest / Immovable secured assets, Mortgage Property mentioned below: Hypthecation of plant and machinery and assets created out of bank finance.

2. In the letter of acknowledgement of debt dated 28.02.2022 you have acknowledged your liability to the Bank to the tune of Rs.98,00,000.00 as on 28.02.2022. The outstanding stated above include further drawings and interest up to 28.02.2024. Other charges debited to the account are Rs. nil.

3. As you are aware, you have committed defaults in payment of interest on above loans/outstanding for the quarter/month ended March 2024. You have also defaulted in payment of installments of term loan/demand loans which have fallen due for payment on 31.12.2023 and thereafter.

4. Consequently upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 30.03.2024 (date of NPA) in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon.

5. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs 69,89,584.87/-(Rupees Sixty Nine Lakhs Eighty nine thousand five hundred and eighty four and paise eighty seven only) + interest thereon, plus unapplied interest plus unsecured interest and plus legal charges plus other charges as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note.

6. Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full.

7. We invite your attention to sub-section 13 of Section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business) without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act.

8. We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/inviting quotations/tender/private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available.

9. Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.

Date: 13.05.2024 Place : Valsad Sd/- Chief Manager & Authorised Officer, Bank of Baroda.

ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તાજેતરના વર્ષોમાં ભૌતિક રીતે સુધારો થયો છે

કાર્યક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિકલ ખર્ચ ઘટાડી શકે, ભારતની ઉત્પાદન સ્પર્ધાત્મકતા સુધારી શકે



નવી દિલ્હી, તા. ૨૦ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તાજેતરના વર્ષોમાં ભૌતિક રીતે સુધારો થયો છે...

વધુમાં, એકદરે આર્થિક સુધારો અને અપેક્ષા કરતાં વધુ ખાનગી મૂડી ખર્ચ L&Tના વિકાસને વધુ ટેકો આપશે...

ત્વરિત ક્ષમતા વિસ્તરણ દ્વારા NTPC માટે સંભવિત ઉછાળો જુએ છે...

ટૂંકાગાળાની અનિશ્ચિતતાઓ હોવા છતાં, અલ્ટ્રાટેક સિમેન્ટ મજબૂત મધ્યમ ગાળાની માંગની દૈશ્યતા ધરાવે છે

અવરોધી શકે છે, જ્યારે સામગ્રી ખર્ચમાં તીવ્ર વધારો માર્જિન પર દબાણ લાવી શકે છે...

NTPCના થર્મલ બિઝનેસનું મૂલ્ય અંદાજિત H1FY27 પ્રાર્થસ-ટુ-બુક રેશિયો કરતાં 2 ગણું છે...

બિઝનેસ ગુણાંક સાથે સુસંગત છે. મોર્ગન સ્ટેન્લીએ નોંધ્યું હતું કે, અમે FY31 સુધીમાં ૩૫% નું કમિશનિંગ ધારીએ છીએ...

ટીટાગઢ રેલ સિસ્ટમ્સ માટે મોર્ગન સ્ટેન્લીનો બેઝ કેસ સપ્ટેમ્બર ૨૦૨૪ની કમાણીના ૩૫ ગણા ટાર્ગેટ પ્રાર્થસ-ટુ-બુક રેશિયો પર આધારિત છે...

ધરા. જો કે, પુરવઠા શુંબલામાં વિક્ષેપ નૂરના વ્યવસાયને અસર કરી શકે છે અને અમલીકરણમાં અવરોધ લાવી શકે છે...

RBI ગવર્નર શક્તિકાંત દાસે બેંકિંગ ક્ષેત્રમાં તકેદારી જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો



નવી દિલ્હી, તા. ૨૦

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે, ગુરુવારે મુંબઈમાં કોલેજ ઓફ સુપરવાઈઝર દ્વારા આયોજિત નાણાકીય સ્થિતિસ્થાપકતા પરની બીજી વૈશ્વિક પરિષદમાં ભાષણમાં...

આ કાર્યક્રમમાં ભોલતા, ગવર્નર દાસે વિશ્વભરમાં નોંધપાત્ર બેંકિંગ નિષ્ફળતાઓના ભૂતકાળના ઉદાહરણો તરફ ધ્યાન દોર્યું...

કાળઝાળ ગરમી અને પુરવઠાની ઘટને કારણે દેશભરમાં ટામેટાના ભાવમાં વધારો

નવી દિલ્હી, તા. ૨૦ કાળઝાળ ગરમી અને પુરવઠાની ઘટને કારણે દેશભરમાં ટામેટાના ભાવમાં વધારો થઈ રહ્યો છે...

ભારે ગરમીની અસર ટામેટાં પર દેખાવા લાગી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ સહિતના દક્ષિણ ભારતીય રાજ્યોમાં ટામેટાંના છૂટક ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે...

મુંબઈ, તા. ૨૦ મંદ માગને પરિણામે દેશના ઓટો ઉદ્યોગ માટે વર્તમાન નાણાં વર્ષમાં ભાવમાં વધારો કરવાનો અવકાશ સરેરાશ પાંચ ટકા સુધી મર્યાદિત જોવાઈ રહ્યો છે...

ચીન તથા અમેરિકા બાદ ભારતનું ઓટોમોબાઈલ માર્કેટ ત્રીજા મોટું માર્કેટ

મજબૂત રહેવા અપેક્ષા છે. નાણાં વર્ષ ૨૦૨૪માં ઓટો ઉદ્યોગનું કદ જે રૂપિયા ૮.૬૦ લાખ કરોડ રહ્યું હતું તે નાણાં વર્ષ ૨૦૨૪માં ૧૯ ટકા વધી રૂપિયા ૧૦.૬૦ લાખ કરોડ જોવા મળ્યું હતું...

ગુપ્તવત શરણના પાદરે બ્રહ્મચર્ય માતાની સાથે યાત્રાની નોંધવેલી અને ઉપવાસ શરૂ કર્યો હતો. ઇન્દ્રવજીરો પાસેથી બેસીને ઉપવાસ શરૂ કર્યો હતો...

ધી કર્મચારી કો-ઓપરેટિવ કેસિટ સોસાયટી લિ. વડોદરા. ગજાનન કોમ્પ્લેક્સ, સરકારી પ્રેસની સામેની ગલી, રામજી મંદિરની પોળ, પુના બોર્ડિંગ હાઉસ પાસે, સલાટવાડા, વડોદરા-૨૨૦૦૦૧.

જૂન મહિનામાં બટાટા, ડુંગળી અને ટામેટાંની સાથે કઠોળના ભાવમાં પણ વધારો થયો



નવી દિલ્હી, તા. ૨૦

જૂન મહિનામાં ટામેટાના ભાવમાં વધારો થયો છે. જૂન મહિનામાં બટાટા, ડુંગળી અને ટામેટાંની સાથે કઠોળના ભાવમાં પણ વધારો થયો છે...

ચણા અને અડદની દાળના સરેરાશ ભાવમાં ૨ ટકાથી વધુનો વધારો નોંધાયો

દાળના સરેરાશ ભાવમાં વધારો થયો નથી. માહિતી સમયગાળા દરમિયાન કિંમતમાં ૦.૭૨ રૂપિયા એટલે કે ૦.૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

જે વધીને ૧૨૬.૬૯ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મતલબ કે આ સમયગાળા દરમિયાન ૦.૯૦ રૂપિયા એટલે કે ૦.૭૧ ટકાનો વધારો જોવા મળ્યો છે...

પશ્ચિમ રેલવે - વડોદરા ડિવિઝન લેવિંગ ઇન્ચાર્જ સેલ. ઈ-ટેન્ડર સૂચના સં. DRB BRC 055 TO 057 OF 2024-25...

નોવોનો તરસાલી શાખા. બેંક ઓફ બારોડા. પબ્લિકિટી - નં. 1304 L (13) કલ્યાણ અંગેની નોટિસ (સ્વાચ્છતા મિલકત માટે)...

Tender Notice. For the following works in Rajpipla municipality area Gov. of Gujarat Registered contractors may apply pricing is available at www.aprocure.com...

20 MICRONS LIMITED. ૨૦ મિક્રોન્સ લિમિટેડ. ૨૦ મિક્રોન્સ લિમિટેડના આરોગ્ય અને સુવિધા ક્ષેત્રમાં અગ્રણી સ્થાન છે...